

B.Com. Semester - 5 (CBCS) Examination

Oct/Nov. - 2019

AUDITING AND CORPORATE GOVERNANCE - 1(DISC. SPE. ELE -1)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1 (A) ભૂલોના પ્રકાર દર્શાવો અને કાચા સરવૈયાને અસર કરતી ભૂલોની વિગતવાર ચર્ચા કરો. (10)

(B) ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતી વખતે તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેશો? (10)

અથવા

પ્રશ્ન-1 (A) ચાલુ ઓડિટના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો.

(B) કમ્પ્યુટરાઈઝડ હિસાબી પદ્ધતિનું મહત્વની ચર્ચા કરો.

પ્રશ્ન-2 (A) આંતરિક અંકુશ એટલે શું? રોકડ વેચાણ અંગે આંતરિક અંકુશની પદ્ધતિ વર્ણવો. (10)

(B) વાઉચિંગ એટલે શું? વાઉચિંગ કરતી વખતે તમે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેશો? (10)

અથવા

પ્રશ્ન-2 (A) આંતરિક અંકુશનું મહત્વ અને તેની મર્યાદાઓની ચર્ચા કરો.

(B) નીચેનાનું વાઉચિંગ તમે કેવી રીતે કરશો. (ગમે તે બે)

(1) ડિવિડન્ડ અને વ્યાજની આવક (2) દેવાદારો પાસેથી મળેલી રકમ

(3) પગાર (4) ઓડિટ ફી

(5) રોકાણો

પ્રશ્ન-3 કંપની ઓડિટરના હક્કો અને ફરજો જણાવો. (15)

અથવા

પ્રશ્ન-3 ઓડિટરની લાયકાત, ગેરલાયકતો, નિમણૂક અને પુનઃનિમણૂક અંગેની કંપનીધારાની જોગવાઈઓ જણાવો.

પ્રશ્ન-4 ટૂકનોંધ લખો. (ગમે તે ત્રણ) (15)

(1) કોર્પોરેટ ગવર્નન્સના હેતુઓ (2) કેડબરી કમિટી રીપોર્ટ

(3) સંચાલક મંડળની રચના (4) કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ

(5) કોર્પોરેટ ગવર્નન્સના મૂળતત્વો(સિદ્ધાંતો) (6) હર્ષદમહેતા કૌભાંડ

ENGLISH VERSION

- Que-1 (A) Describe the types of errors and discuss in detail the errors affecting the trial balance. (10)
- (B) While preparing audit programme which points will you take into consideration? (10)

OR

- Que-1 (A) Discuss the advantages and disadvantages of continuous audit.
- (B) Importance of computerized accounting system.

- Que-2 (A) What is internal check? State the method of internal check for cash sales. (10)
- (B) What is Vouching? Which points will you take into consideration while vouching? (10)

OR

- Que-2 (A) Discuss importance and demerits of internal check.
- (B) How will you do the vouching of the following? (Any Two)

- | | |
|-------------------------------------|--------------------------------|
| (1) Income from dividend & interest | (2) Cash received from debtors |
| (3) Salary | (4) Audit fee |
| (5) Investments | |

- Que-3 State the rights and duties of company auditor. (15)

OR

- Que-3 What are the provisions of the companies Act related to qualification disqualification, appointment, reappointment of the auditor?

- Que-4 Write Short notes: - (Any Three) (15)

- | | |
|--|--------------------------------|
| (1) Objectives of Corporate Governance | (2) Cadbury committee report |
| (3) Creation of Board of Directors | (4) Corporate Governance model |
| (5) Principles of Corporate governance | (6) Harshad Mehta scam. |
